



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૬/૦૭/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૯૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૩ કેસ કરી, ૪૧ વ્યક્તિઓને ઝડપી, ૨૪૨ લીટર દેશી દારૂ, ૧૫૩ બોટલ ઈંગ્લીશ દારૂ, ૮૦૯ ક્વોટર ઈંગ્લીશ દારૂ, અને ૧ સ્કુટર કબજે કર્યું હતું. જુગાર ધારા હેઠળ ૦૫ કેસ કરી, ૧૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬,૯૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૯૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૧૯૩/૧૯

શહેરકોટડા : નેહાબહેન વા/ઓ પંકજભાઈ કોઠારી (ઉ.વ.૩૩)(રહે,સ્પેક્ટ્રમ ટાવર, શાહીબાગ) તા.૧૫/૦૭/૨૦૧૯ સવારના ૭/૦૦ વાગ્યાના સુમારે કાલુપુર બ્રીજના છેડે અમદુપુરા તરફ બિજ ઉતરતા સુમેલ બિઝનેશ પાર્ક સામેથી પતિ સાથે એક્ટીવા પાછળ બેસી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ ભેગામળી નેહાબહેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ નેહાબહેન કોઠારી એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.ડી.ચાવડા ચલાવે છે.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૧૧૯૪/૧૯

નારોલ : રમેશ શિવકરણ જાટ (રહે. જીતેન્દ્ર કોલોની કૈલાસનગર સૈજપુર) એ તા.૧૫/૭/૧૯ નારોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૭/૧૯ રાતના ૧૦/૩૦ થી તા.૧૫/૦૭/૧૯ સવારના ૯/૦૦ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે નારોલ કેલીકોનગર અગ્રવાલ એસ્ટેટ, “નિર્મલ રોડવેજ” નામના ગોડાઉન નં.૧-૨ નું શટર ઉંચું કરી, અજાણી વ્યક્તિ ગોડાઉનમાં પ્રવેશ કરી, ગોડાઉનમાંથી જુદા-જુદા કાપડની ગાસડીઓ કુલ-૧૫૭ કિંમત રૂપિયા ૨૫,૪૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.એ.જાદવ ચલાવે છે.

વટવા જી.આઇ.ડી.સી. : જીતેન્દ્ર ભારતભાઈ પરમાર (ઉ.વ.૨૬) (રહે.આકાર ઓટો એસેસરીસ કંપની ફેઝ-૧ જી.આઈ.ડી.સી. વટવા) તા.૧૫/૭/૧૯ સવારના ૫/૦૦ વાગ્યાના સુમારે વટવા જી.આઈ.ડી.સી. ફેઝ-૧ ખાતે આવેલ “આકાર ઓટો એસેસરીસ” નામની ફેક્ટરીમાં એસેસરીનો સામાન પોલીસ કરી લોખંડના ઘોડામાં મુકવા જતા, અચાનક ઘોડા સાથે ચોટી જતા, કરંટ લાગતા નીચે પડી જતા સારવાર માટે તેમને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડૉ.શ્રી એ કલાક ૭/૦૦ વાગે મૃત જાહેર કર્યા હતા. આ અંગે વટવા જી.આઈ.ડી.સી. પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.સી.જાડેજા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.